

## ૨ (૭) કંકુ કાજલ

### ૧. પ્રસ્તાવના

#### અ. ઉપયોગીતા :-

કંકુ તથા કાજલનું સ્થાન સ્ત્રીઓના પ્રસાધનોમાં અગત્યનું સ્થાન ધરાવે છે અને તેનો વપરાશ શહેરો તથા ગામડાઓમાં ખૂબ જ છે. કેસરી, લાલ, ગુલાબી, લીલો વગેરે રંગના કંકુનો ઉપયોગ પ્રવાહી કુમકુમ તેમજ એન્સીલના સ્વરૂપમાં પ્રચલિત છે. કોર્ટ પાવડર કંકુ ખાસ કરીને ધાર્મિક સ્થળોએ પૂજાપાઠમાં વપરાશ છે. આ જાણેય પ્રકારના કુમકુમનું ઉત્પાદન સરળતાથી થઈ શકે છે. કાજલ આંખ માટે ખૂબ ઉપયોગી છે. સ્ત્રીઓના હૃંગારમાં કાજલનું અગત્યનું સ્થાન છે. બાળકોની આંખમાં આંગંવા માટે પણ કાજલ વપરાશ છે.

#### બ. બજાર અને બજાર વ્યવસ્થા :-

ઉત્પાદક જાને નાલુકા અથવા છલ્લા કક્ષાને વેચાણ માટે બજાર અને બજાર વ્યવસ્થા ઉભા કરવાની રહેશે. આ અંગે કોઈ સરકારી સંસ્થા કે નિગમો વેચાણ કરતાં નથી.

#### ક. ધારણાઓ :-

આ ઉદ્યોગ કુટિર તરીકે શરૂઆતમાં જરૂરી સાધનો તથા એકાદ-બે માણસોને રોકીને કારવાનો છે. આ કુટિર ઉદ્યોગ નાલુકા અથવા છલ્લા કક્ષાના મથકે થર્ડ કરવામાં આપશે તે રીતે ખર્ચની ગણતરી કરેલ છે.

### ૨. ઉત્પાદન પ્રક્રિયા :-

કંકુ માટે જરૂરી કાચોમાલ જેવો કે સ્ટાર્ચ, ગુંડર રંગ વિ.ને યોગ્ય પ્રમાણમાં વજન કરવું. ત્યારબાદ સધળા કેમીકલોને બોલમીલમાં સારી રીતે મિક્સ કરવા ત્યારબાદ ડઝીમાં પેક કરવું. "પ્રવાહી કંકુ માટે સ્ટાર્ચ, ગુંડર રંગ, વગેરે કાચોમાલને જોઈના પ્રમાણમાં વજન કરી મીકસીંગ મીલમાં સીરી રીતે મિક્સ કરવું. સારી રીતે મિક્સ થયા બાદ પ્લાસ્ટીક શીથીમાં પેક કરવું. કાજલ માટે જરૂરી કાચોમાલ મીણ મિનરલ ઓઈલ, કાર્બન વિ.ને યોગ્ય પ્રમાણમાં વજન કરી મિકસીંગ મીલમાં સારી રીતે મિક્સ કરવા. ત્યારબાદ સ્વરંગ ડઝીમાં પેક કરવા.

### ૩. ઉત્પાદનક્ષમતા :-

એકમની ઉત્પાદન ક્ષમતા ૧૬૦ ડબા/બોટલ પ્રતિદિનની છે. પરંતુ વર્ષમાં ૫૦% ક્ષમતા ગણતાં દૈનિક ઉત્પાદન ૮૦ ડબા/બોટલ ગણેલ છે.

### ૪. પરવાના અંગેની ખાસ જરૂરિયાત :-

કુમકુમ બનાવવા માટે ઔષ્ણ નિયમન તંત્ર તરફથી ઔષ્ણથી અને સૌદા પ્રસાધન એકટના ધારા ધોરણ મુજબ લાયસન્સ મેળવવું અનિવાર્ય છે. તેમજ કુમકુમ બનાવવા માટેની પદ્ધતિસરની નાલિમ હીપેલી હોવી જોઈએ. પરવાના મેળવતાં પહેલા સાધનો અને મર્દીનરી હોવા આપરિયક છે.

**૫. સ્થાપી મૂડી રોકાળ :-**

**અ. જમીન/મકાન**

આ ઉદ્યોગ શરૂ કરવા માટે અંદાજ  $20' \times 20' = 400$  ચો. ફુટ હવા ઉભાસ વાળી બાંધેલી જગ્યાની જરૂરિયાત રહે.

**બ. પ્લાન્ટ/મશીનરી/સાધનો/ફન્નાચિર વિ.**

અ.નં.	મશીનરીનું વાર્ષિક	સંખ્યા	કિમત (રૂ.)
૧	૨	૩	૪
(૧)	બોલમીલ ૧ હો.પા. સીંગલ ફેઈઝ વાયરિંગ કેપેસીરી ૫ કિ.ગ્રા.	૧	રૂ. ૭,૦૦૦/-
(૨)	ઓઇન્ટમેન્ટ મીક્સીંગ મશીન(મીલ)	૧	રૂ. ૫,૦૦૦/-
(૩)	ડાઇ એન્સીલ બિન્દી માટે (૩૦ હોલ)	૧	રૂ. ૧,૦૦૦/-
(૪)	ગ્રાંજવો-તોલા, ગરમ કરવાના વાસણો, પ્રાયમસ,		
	ગરણી, મીક્સ કરવા તથા સુકવવા માટે ટ્રે,		
	તથા પરચુરણ સાધનો	-	રૂ. ૨,૦૦૦/-
<b>કુલ</b>			રૂ. ૧૫,૦૦૦/-
<b>ક. ઓફીસ ફન્નાચિર વિ. :-</b>			
	કબાટ, ટેબલ, ખુરણી, ધોડા, સ્ટુલ વિગેરે.		રૂ. ૪,૦૦૦/-
<b>૬. કુલ સ્થાપી મૂડી રોકાળ :-</b>			રૂ. ૧૮,૦૦૦/-
<b>૭. ચાલુ મૂડી (કાર્પકારી બંડોળ) :-</b>			
	કાચોમાલ જેવો કે સ્ટાર્ચ, ગુંદર, મીણ, રંગ, સુગંધ, કાર્બન તથા આવી ડબ્બીઓ, પ્લાસ્ટીક બોટલ,		
	લેબલ ૧ માસનો તથા ૧ માસનો પગાર અને પાવર ખર્ચ મળીને કુલ		રૂ. ૪,૦૦૦/-
<b>૮. કુલ મૂડી રોકાળ :-</b>			રૂ. ૨૩,૦૦૦/-/-
<b>૯. બેંક લોન (પ્લાન્ટ/મશીનરી તથા કાર્પકારી બંડોળ) :-</b>			
	બેંક લોન ૩ (ગણ) માસના મોરેટોરીયમ પીરીયડ બાદ ૪૮ માસિક હમારીં ભરપાઈ કરવાની રહે.		
	વ્યાજનો દર ૧૨ ટકા ગણેલ છે.		રૂ. ૨૩,૦૦૦/-
<b>૧૦. આવર્તક ખર્ચ (ઉત્પાદન ખર્ચ) માસિક :-</b>			
<b>અ. કાચોમાલ</b>			રૂ. ૨,૫૦૦/-
<b>બ. પગાર ખર્ચ</b>			
૨ વ્યક્તિ $\times$ રૂ. ૨૪/- દૈનિક $\times$ ૨૫ દિવસ			રૂ. ૧,૨૦૦/-
<b>૮. પાવર ખર્ચ</b>			રૂ. ૩૦૦/-
<b>૯. બેંકનો હમો વાજ સાથે</b>			રૂ. ૪૬૦/-

૧.	પેકિંગ ખર્ચ	રૂ. ૨૦૦/-
૨.	ધસારા ખર્ચ	રૂ. ૨૦૦/-
૩.	રીપેર, સ્ટોર્સ, અન્ય વપરાશી વસ્તુ વિ.	રૂ. ૨૦૦/-
૪.	મકાન ભાડું	રૂ. ૫૦૦/-
૫.	અન્ય ખર્ચ	રૂ. ૧૫૦/-
	કુલ આવર્તક ખર્ચ	રૂ. ૫,૭૭૦/-

#### ૧૧. કુલ વેચાણ (માસિક) :-

મહિનાના ૨૫ દિવસ કામના ગણના માસિક ઉત્પાદન :

(૧)	૧૦૦૦ પેકેટ બિન્ડી પેન્સીલ $\times$ રૂ. ૨/- લેખે	રૂ. ૨,૦૦૦/-
(૨)	૧૦૦૦ બોટલ પ્રવાહી કંકુ $\times$ રૂ.૨/- લેખે	રૂ. ૨,૦૦૦/-
(૩)	૧૦૦૦ ડાય્ઝી કોર્સ કંકુ $\times$ રૂ. ૧.૨૫/- લેખે	રૂ. ૧,૨૫૦/-
(૪)	૧૦૦૦ ડાય્ઝી કાળાલ $\times$ ૨.૫૦ લેખે	રૂ. ૨,૫૦૦/-

કુલ

રૂ. ૭૭૫૦/-

#### ૧૨. નફનોટાનો અંદાજ (માસિક) :-

કુલ વેચાણ માસિક

રૂ. ૭,૭૫૦/-

બાદ : માસિક આવર્તક ખર્ચ

રૂ. ૫,૭૭૦/-

ચોખ્ખો નફો માસિક

રૂ. ૨,૦૪૦/-

#### ૧૩. અન્ય વિગતો :-

વેચાણ માટે નળીકના શહેરોમાં તથા ગામંડાઓમાં પ્રોવિઅન સ્ટોર મારફતે તથા ધ્યામિક સ્થળોએ સાડુ વેચાણ થઈ શકે. કાચોમાલ કેવો કે સ્ટાર્ચ, ગુંડર, મીણ, રંગ, ચુંગાધ કપુર વિ. નીચેના સરનામા ઉપરથી મળશે.

#### ૧૪. ખાસ નોંધ :-

આ કુટિર ઉદ્યોગની પદ્ધતિસરની તાલીમ ડાયમંડ જ્યુબીલી કોટેજ, ઈન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટીટ્યુટ, વડોદરામાં આપવામાં આવે છે.

#### ૧૫. કાચામાલના ઉત્પાદકો/વિતરકો :-

૧ મે. અમૃતનલાલ ભુરાભાઈ એન્ડ કુ. પો.બો.નં. ૨૩૭૮ આનંદ ભુવન, શામળાસ ગાંધી માર્ગ,  
મુંબઈ-૪૦૦૦૦૧.

૨ મે. રાજકમલ પ્રોડક્ટ્સ, ૮૩ કસુંભાવાડ, દોશીવાડા પોણ, અમદાવાદ.

૩ રંગ માટે :-

માધ્યમિક માણીલાલ એન્ડ કુ. નારાયણની ચાલ, આસ્ટોડીયા રોડ, અમદાવાદ.

#### ૧૬. મશીનરી/સાધનો/ડાઈઝટલસના ઉત્પાદકો/વિતરકો :-

૧ મે. પાયોનીયર એન્જિનીયરીંગ કુ. ૫૭, એપોલો સ્ટ્રીટ, મુંબઈ.

૨ મે. સાયન્ટિક ટ્રેડિંગ કોર્પોરેશન, ૩૦૮, ન્યૂ કલોથ માર્કેટ, રેલ્વેપુરા-અમદાવાદ.